

Est

Chapter 10

Gujarati Interlinear

Reference: American Standard Version

1 וַיִּשֶׁם אֶנֶּ-בַּאֲדִי אַחַשְׁוֶרֶשׁ | אֶת־הָאֲרָץ | אֶת־הַיָּם
સમુદ્રના અને-ટાપુઓ ભૂમિ પર કસ (blank) અહાશ્વેરોશ રાજાએ અને-બાધી
[H3220](#) [H0339](#) [H0776](#) [H4522](#) [H0325](#) [H0325](#) [H4428](#)

And the king Ahasuerus laid a tribute upon the land, and upon the isles of the sea.

2 וְכֹל-מַעֲשֵׂה תְקִפּוֹ וְגִבּוֹרָתוֹ | וְיִפְרָשֶׁת | גְּדֻלַּת | מְרָדְכָי | אֲשֶׁר | גְּדָלוֹ
મહાન-બનાવ્યો જેને મોદબાયનું મહાનતાનું અને-વિવરણ અને-તેને-પરાક્રમનું તેનું-શક્તિના કાર્યો અને-બધાં
[H1431](#) [H4782](#) [H1420](#) [H6575](#) [H1369](#) [H8633](#) [H4639](#) [H3605](#)

הַמְּלָכִי הַלְּוָא-הַ | כְּתוּבִים | עַל-סֵפֶר | הַיְבֵרִי | הַיָּמִים | לְמַלְכֵי | מְדֵי | וּפְרָס:
રાજાએ તે શું રાજાઓને દિવસોનું વાતોના પુસ્તક માં લખેલાં તે તે મોદબાયનનાં અને-ફારસને માદી
[H6539](#) [H4074](#) [H4428](#) [H3117](#) [H1697](#) [H3789](#) [H1992](#) [H3808](#) [H4428](#)

And all the acts of his power and of his might, and the full account of the greatness of Mordecai, whereunto the king advanced him, are they not written in the book of the chronicles of the kings of Media and Persia?

3 כִּי מְרָדְכָי הַיְהוּדִי | מְשֻׁנָּה | לְמַלְכֵי | אַחַשְׁוֶרֶשׁ | וְגִדּוּל | לַיְהוּדִים | וְרָצוּי | לְרֹב
કારણ-કે મોદબાયનનાં કારણે બીજાં રાજાને અહાશ્વેરોશને અને-મહાન અને-ગદાનું આચાર્ય અને-માન્ય યહૂદીઓમાં શાંતિ અને-માટે
[H7230](#) [H7521](#) [H3064](#) [H0325](#) [H4428](#) [H4932](#) [H3064](#) [H4782](#)

אֲחִיו | הָרַשׁ | טוֹב | לְעַמּוֹ | וְדָבָר | שְׁלוֹם | לְכָל- | זָרְעוֹ:
તેને-ભાઈઓમાં શોધતો-હતો ભલાઈ તેને-પ્રજા-માટે અને-બીલતો-હતો શાંતિ અને-માટે તેને-વંશને બધાં-માટે
[H2233](#) [H3605](#) [H7965](#) [H1696](#) [H1875](#) [H0251](#)

For Mordecai the Jew was next unto king Ahasuerus, and great among the Jews, and accepted of the multitude of his brethren, seeking the good of his people, and speaking peace to all his seed.